



# પંચાયત જગત

વર્ષ : ૬ અંક : ૨ સાલં અંક : ૨૭ માર્ચ-એપ્રિલ ૨૦૦૫

ફક્ત અંગત વિતરણ માટે

## બે કરતાં વધુ બાળકો હોય તેને પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ગણવાનો નવો સુધારો દીકરીઓ અને મહિલાઓ માટે અન્યાયી નીવડશે

- ઈલા પાઠક

ગુજરાત સરકારે ગઈ વિધાનસભાના આરંભના દિવસોમાં ૧૭ માર્ચ, ૨૦૦૫ના દિવસે 'ગુજરાત સ્થાનિક સત્તામંડળોને લગતા કાયદા (સુધારા) વિધેયક ક્રમાંક ૧૭,૨૦૦૫' પસાર કરી દીધું. આ વિધેયેકના ઉદ્દેશો અને કારણોમાં જણાવાયું છે કે ભયજનક રીતે વધતી વસ્તીનું નિયંત્રણ કરવા આ સુધારો જરૂરી લાગ્યો છે. આ સુધારા ખરડામાં નિર્દેશેલી જોગવાઈ પ્રમાણે બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિને પંચાયતના સભ્ય કે નગરપાલિકા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર થતા અટકાવી શકાય.

આ ખરડો રજૂ કરનાર મંત્રીશ્રીના મત પ્રમાણે આ રાષ્ટ્રીય વસ્તી નીતિના અમલીકરણની દિશામાં મહત્વનું પગલું છે. ઉપરાંત તેમણે જણાયું કે 'આ કાયદો ભવિષ્યલક્ષી અસર ધરાવતો હોવાથી એ મતલબની જોગવાઈ કરી છે. મંત્રીશ્રીનાં આ વિધાનો આશ્વર્યકારક લાગે છે કે કેમ કે રાષ્ટ્રીય વસ્તી નીતિ (૨૦૦૦) અને ગુજરાત રાજ્ય વસ્તી નીતિ (૨૦૦૨) બંનેમાં વસ્તી નિયંત્રણનું ધ્યેય સ્વીકાર્યું હોવા છતાં પ્રોત્સાહનનાં કે દંડનાં (ઇન્સેન્ટિવ કે ડીસર્વન્સેન્ટિવ) પગલાં ન જ લેવાં તેવું નક્કી કર્યું હતું. વસ્તી નિયંત્રણ માટે વિશ્વમાં સ્વીકારાયેલાં આરોગ્ય સુધારણા અને કુટુંબ કલ્યાણનાં પગલાં લેવાય તેવો જ આગ્રહ ત્યારે રાખ્યો હતો. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય વસ્તી અંગેની પરિષદમાં પણ પ્રજનન આરોગ્યની સંભાળ લેવા પરતે જ સંમતિ દર્શાવી હતી. તો ગુજરાતમાં આ સર્વ અને પોતાની ૨૦૦૨માં સ્વીકારેલી નીતિ પણ વિસારે પાડવાનું શું કારણ હોય? મંત્રીશ્રીએ ઉદ્દેશો અને કારણોમાં ઉલ્લેખ કર્યો છે કે આ સુધારો કરીને તેઓ રાષ્ટ્રીય વસ્તી નીતિ (૨૦૦૨) નું પાલન કરી રહ્યા છે!

મંત્રીશ્રીના મત મુજબ આ સુધારાની ભવિષ્યલક્ષી અસર પડશે. વસ્તી નિષ્ણાતો કંઈક બીજું જ કહે છે. ૨૦૦૫ની સાલ સુધીમાં ગુજરાતની વસ્તી વધીને ક કરોડ ૮૧ લાખની થશે તેવું ગણિત છે. દરેક યુગલ ફક્ત ૨.૧ બાળકોને જન્મ આપે

તો પણ વસ્તીવધારાની આ ગતિ રહેશે જ કેમ કે ગુજરાતમાં બાળકોને જન્મ આપે તેવી ચુવાન વસ્તી ઘણી વધુ છે. એટલે કુટુંબમાંની સભ્ય સંખ્યા ગૌણ બને છે. પ્રજનનક્ષમ વસ્તી વધુ હોવાથી વસ્તી વધવાની જ છે. તો આ સુધારા પાછળ કયા ભવિષ્યની ગણતરી હશે?

આપણા ગુજરાતની અન્ય વાસ્તવિકતા એવી છે કે મોટા ભાગની ઓ.બી.સી., એસ.સી. અને એસ.ટી. જ્ઞાતિઓમાં/જૂથોમાં બાળબળનો અત્યંત પ્રચલિત છે. આને કારણે કન્યા યુવતી બનીને પોતાની શારીરિક પ્રક્રિયાઓ વિશે સભાન થાય ત્યાં સુધીમાં બે કે ત્રણ બાળકોની માતા બની જાય છે. આના કોઈ આંકડા માળવા શક્ય નથી કેમ કે બધા જાણે છે કે લગ્ન માટે ઓછામાં ઓછી ઉંમર ૧૮ હોય તેવી માની ઉંમર ૧૮ જ લખાવાય! આમ છતાં નેશનલ ફેમિલી હોલ્દ્ય સર્વે-૨ (૧૯૯૮-૯) અને જિલ્લા કક્ષાનાં કુટુંબોના સર્વેના આંકડા (બીજો રાઉન્ડ, ફેઝ ૧)માં જણાવ્યા પ્રમાણે ચારથી વધુ બાળકો ધરાવતી સ્ત્રીઓમાંથી ૫૪% સ્ત્રીઓએ ઓછાં બાળકો હોવા જોઈએ તેવું જણાયું છે. ત્રણ બાળકો ધરાવતી સ્ત્રીઓમાંથી ૪૮ સ્ત્રીઓએ ઓછાં બાળકો હોવા જોઈએ તેવું જણાયું છે. સ્પષ્ટ છે કે સ્ત્રીઓ ઈછે તેના કરતાં વધુ બાળકોને તેમણે જન્મ આપવો પડે છે. તેનો અર્થ એવો કરીએ કે આપણે સ્ત્રીઓને જરૂરી તેવી પ્રજનનને લગતી સેવાઓ પહોંચાડી નથી. સરકારે સ્ત્રીઓને ગર્ભનિયંત્રણનાં સાધનો અને તેના ઉપયોગનું શિક્ષણ પહોંચાડું વધુ જરૂરી જણાય છે. નિષ્ણાતો એવું પણ કહે છે કે જન્મેલું દરેક બાળક જીવે તેવી પરિસ્થિતિ ઉભી કરી શકીએ તો પણ વસ્તી નિયંત્રણ આપોઆપ થવા માંડે!

હકીકતે આવું બધું નિષ્ણાતો વર્ષોથી કહે છે. એટલું જ નહીં, સરકારે ૨૦૦૨માં ગુજરાતમાં, ૨૦૦૦માં ભારતમાં અને તેથી પહેલાં વૈશ્વિક સ્તરે તે બધું સ્વીકાર્યું જ છે, છતાં ફરીથી આવો 'સુધારો' (?) શા માટે? અમને દુઃખ એક બીજી વાતનું પણ છે. પંચાયત/મ્યુનિસિપાલિટી/ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે

અંદરનાં પાને : ચિત્રવાર્તા-૬ : સામાજિક ન્યાય ને આત્મસન્માન, વંચિતોને અધિકાર અને આપીએ બદ્ધમાન

ચૂંટણીમાં ઉભા રહેનારાને બે બાળકોથી વધુ ન હોવાં જોઈએ તેવો સુધારો દીકરીઓના જન્મ સામે ખતરો ઉભો કરે છે. ગુજરાતી સમાજમાં દીકરાના જન્મને જ વહાલો ગણતા ગુજરાતીઓ દીકરી પ્રત્યે વધુને વધુ ભેદભાવ રાખશે. અત્યારે જ દીકરીની સંખ્યા દીકરાઓ કરતાં ઓછી છે. આ સુધારો અમલમાં આવ્યા પણી દીકરી જન્મવાની છે એવું ખબર પડે એટલે તેની ભૂષણ હત્યા થશે. દીકરી જન્મે પછી તેનો ત્યાગ, બાળપણમાં કુપોષણ અને ઈલાજભેદથી તેનાં અપમૃત્યુ થવાની સંભાવના વધશે. જેને પુરીજન્મ થયો તે પલીનો ત્યાગ કરવા જેવા અનેક સ્ત્રી વિરોધી દુષ્કૃત્યોમાં વધારો થશે તેવું અમે સમજીએ છીએ તેથી તેનો ડર પણ લાગે છે. વધુમાં જાણવા મળ્યું છે કે જે રાજ્યમાં બેથી વધુ બાળકો હોય તે વ્યક્તિ પંચાયતો વગેરેમાં ચૂંટાઈ શકે નહીં તેવો કાયદો થયો છે. આ ચૂંટાયેલા સભ્યોને પંચાયતોમાંથી બાકાત કરવામાં આવ્યા છે. સ્ત્રીઓને દુઃખી કરવા માટે સરકારે આ ‘સુધારો’ સુચયો જ નહીં હોય તેવું માનવા અમે તૈયાર છીએ. જેમ ઉપર જણાવેલી અનેક નીતિઓ તેમ જ નિષ્ણાતોના અભિપ્રાયો પર દીર્ઘ વિચારણા ન કરી, તેમ સ્ત્રીઓ વિશેના મુદ્દાનું પણ થયું લાગે છે. ગુજરાત સરકાર આ ‘સુધારો’ કાયદામાં પરિવર્તિત ન કરે તેવું ઈચ્છીએ. હવે એક છેલ્લી વાત, સુધારા ખરડામાં અંગ્રેજીમાં જણાવ્યું છે

કે, ‘બોખે પ્રોવિન્શિઅલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૮ની કલમ ૧૦ની પેટાકલમ-૧ ના કલોઝ (આઈ) પછી કલોઝ(જે) ઉમેરવું. ઉપર જણાવેલો કાયદો જોતાં એવું સમજાય કે તેની કલમ-૧૦ની પેટાકલમ-૧માં (એચ) સુધી જ કલોઝ છે એટલે નવું કલોઝ (આઈ) તરીકે જ મૂકવા જેવું હતું. કાયદા કરવાના લખાણમાં આવી બેદરકારીની અપેક્ષા ન હોય !

ચૂંટણીમાં કઈ કઈ વ્યક્તિઓ ભાગ ન લઈ શકે તેને લગતી આ કલમ-૧૦ છે. તેવી જ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૮૩માં કલમ-૩૦ છે. આવી કલમોમાં ગેરલાયકાતનાં લક્ષણોમાં તે વ્યક્તિ જેલમાં ગુનેગાર તરીકે સાજા ભોગવી ચૂકી હોય, નાદાર હોય, જે વ્યક્તિએ આગલાં લહેણાં ભરપાઈ કર્યા ન હોય, તેવાને મૂકવામાં આવ્યા છે. આ યાદીમાં જ બે કરતાં વધુ બાળકો ધરાવતી હોય તેવી વ્યક્તિને મૂકી દેવાનું અજુગતું લાગે છે.

વધારામાં બાળકોની સંખ્યા વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં ઉભા રહેવા માંગતા હોય તેને નડવાની નથી તે નક્કી છે. આ પંચાયતો, મ્યુનિસિપાલિટીઓ અને મ્યુનિ. કોર્પોરેશન એ શું કર્યું કે તેમની પર આવી તવાઈ લાગ્યા ! અને તે પણ પહેલાં સ્વીકારેલી નીતિઓ, નિષ્ણાતોના અભિપ્રાયો, સ્ત્રીઓની સ્વસ્થતા બધું જ નેવે મૂકી દઈને ? ખમેયા કરોને ! ■

(શ્રી ઈલાબહેન પાઠક, ‘અવાજ’ સંસ્થાનાં નિયામક છે.)

## દંડનો ડર, વડીલો પ્રત્યેનો આદર તેમને દાર્થી દૂર રાખે છે !


શું કડક કાયદા, મહાત્મા ગાંધીના ઉપદેશ કે સરકાર દ્વારા પ્રોત્સાહનથી દારૂબંધીનો અમલ કરાવી શકાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે, મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાનાં ચાર આદિવાસી ગામના રહેવાસીઓને આ પેકી એકેય વિકલ્ય લાગુ પડતો નથી. આ ગામોના રહેવાસીઓ દારૂબંધીનો અમલ એ કારણસર કરે છે કે તેઓ તેમના વડીલોનો આદર કરે છે. બીજું કારણ એ પણ છે કે, દેશી દારૂ બનાવનારે ફટકારવામાં આવતો રૂ.૧૦૦૦ દંડ ચૂકવવાનું તેમને જરાય પરવડે તેમ નથી.

ચાપરા, બરેલી-પાતાર, સિલ્વારામાનપુર અને નકાટિયાના રહેવાસીઓએ આ કાર્યના શ્રીગણેશ ગત વર્ષ કર્યા હતા. ચાપરામાં તો દારૂબંધી છેલ્લાં ૧૫ વર્ષથી અમલમાં હતી, પરંતુ બાકીનાં ત્રણ ગામમાં દર રોજ કંકાસ થતો હતો. પરિસ્થિત હદ બહાર જતાં આ ગામોના વડીલોએ સમસ્યા અંગે ચર્ચા કરવા તમામ રહીશોની એક બેઠક બોલાવી અને સુનિષ્ઠિત કર્યું કે, વડીલોના આદેશનો કોઈ ભંગ કરશે નહીં. પંચાયતે નિયમ ઘડયો કે, દેશી દારૂ બનાવતાં ઝડપાશે તેને રૂ.૧૦૦૦નો દંડ કરશે.

**દારૂબંધીને વરસ વીતવા છતાં હજુ સુધી એકેક્ય ગુનો નોંધાયો નથી : ગ્રામજનોએ તબીબી હેતુસર દારૂનો ઉપયોગ પણ બંધ કરી દીધો છે.**

આ વાતને આજે વરસ વીત્યું છે અને હજુ સુધી એક પણ ગુનો નોંધાયો નથી. ૧૫૦૦ ઉપરાંત વસ્તી ધરાવતા આ ગામના રહીશોએ ધાર્મિક કે તબીબી હેતુસર દારૂનો ઉપયોગ પણ બંધ કરી દીધો છે. જબલપુરથી ૫૦-૫૫ કિ.મી.ના અંતરે આવેલા, માર્ગ-વીજળીની સુવિધાથી વંચિત એવા આ ગામોના મોટાભાગના રહીશો નિરક્ષર છે, જેઓ તેમના વડીલો અને પંચાયતની વાત જ કાને ધરે છે.

દારૂનું સેવન એ આદિવાસીઓની જિંદગીનો એક અભિન હિસ્સો હોવાથી તેમના વડીલોએ એ અંગે વિચાર્યું નહોતું કે દારૂબંધી યુવાનોને કામ તરફ પાછા વાળવા માટેનો વિકલ્ય બની શકે છે, પરંતુ પલીની માર્ગુડના કિસ્સા બહાર આવતા ગોંદના વડીલોએ તેમની દાયકાઓ જૂની પરંપરા તોડવાનો નિર્ણય કર્યો. જોકે, આ ગામોમાં ફૂંકાયેલા પરિવર્તનના આ વાયરાથી સત્તાવાખાઓ અજાણ છે. દારૂબંધીના અમલ માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા માટે કોઈ પુરસ્કારની ઘોષણા કરાઈ નથી, પરંતુ નવી વિધાનસભામાં ગોંદવાણા ગણતંત્ર પાર્ટીના ત્રણ ધારાસભ્ય હોવાથી સ્થિતિ બદલાઈ શકે છે. ■



## કાયદાની જાણકારી અને મક્કમ મનોબળથી મેં સફળતા મેળવી : કિલુબહેન ગામીત

મારું નામ કિલુબહેન જે. ગામીત છે. હું સુરત જિલ્લાના સોનગઢ તાલુકાના નિશાશા ગામની વતની છું. ગામમાં ૨૦૦૦ લોકોની વસ્તી છે. એક મહિલા સરપંચ તરીકે કામ કરતાં મને ધણા અનુભવો થયા છે. જ્યારે વર્ષ ૨૦૦૨માં અમારી પંચાયતની ચૂંટણી થઈ ત્યારે ગામના અમુક આગેવાનોએ મને ચૂંટણીમાં ઉભા રહેવાની ના પાડી હતી. આગેવાનો કહેતા કે, “આ છોકરી શું કરી શકવાની છે ?” હું સરપંચ તરીકે ચૂંટાઈ પછી મારી કામગીરી જોઈને મારામાં લોકોને વિશ્વાસ બેઠો.

મેં સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો તે પહેલાં તલાટી કમ મંત્રી અમારી પંચાયતમાં અનિયમિત હતા. મેં તલાટીને કડક ભાષામાં કહી દીધું કે, “તમારે અઠવાડિયામાં બે વખત મંગળ અને શુક્રવારે પંચાયત ઓફિસમાં બેસવું જ પડશો.” તલાટીએ મારી વાત માનવી પડી, કારણ કે હું એક ચૂંટાયેલી જાગૃત સરપંચ છું. હવેથી તલાટી નિયમિત રીતે ઓફિસમાં આવે છે.

ગયા વર્ષ અમારા ગામમાં એક બનાવ બન્યો. ગામના એક બહેનને એના બનેવી સાથે આડો સંબંધ હતો. આ આડા સંબંધની તેના પતિને જાણ થઈ ગઈ. પતિથી આ વાત સહન ન થતાં તેણે ગાળે ફાંસો ખાધો, તેમ છતાં તે જીવી ગયો. ત્યારપછી એક સરપંચ તરીકે મેં બહેનના પતિને સમજાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. ત્યારબાદ આડો સંબંધ રાજનાર ભાઈને બોલાવીને સાડા આઠ હજાર રૂપિયાનો દંડ કર્યો. દંડ કરવા પાછળનો મારો હેતુ એ હતો કે, ગામમાં ફરીવાર આવું કોઈ ન કરે અને કોઈના સંસારમાં તિરાડ ન પડે. દંડની રકમમાંથી અડધી રકમ મેં પંચાયતમાં જમા લીધી અને ગામના વિકાસનાં કામો માટે લોકફાળા તરીકે અનામત રાખી. બાકીની રકમ આપદ્યાત કરવાની કોશિશ કરનાર પતિને દવા અને હોસ્પિટલના ખર્ચ માટે આપી. મેં આ બધા નિર્ણયો પંચાયતના સૌ સભ્યોને સાથે રાખીને લીધા છે.

**આખરે અમારા ગામની સંગઠન-શક્તિની જીત થઈ.**  
ટીડીઓ સાહેબે અગાઉની ગ્રામ સભામાં થયેલા દરાવો મુજબ શાળાના બે ઓરડા, શાળાનાં કમ્પાઉન્ડની દિવાલ, આંગણવાડી રિપેન્ટિંગ અને છ કિલોમીટરનો પાકો રસ્તો કરી આપવાની બાંયધરી આપી. આંગણવાડી રિપેર કરવાનું કામ તો પૂરું પણ થઈ ગયું. હાલમાં શાળાના બે ઓરડા બાંધવાનું કામ ચાલુ છે. પહેલાં અમારા ગામમાં લોકો સંગઠિત નહોતા, ગ્રામ સભાનો વિરોધ કરવાના પ્રસંગે સૌ કોઈ એક થઈ ગયા એનો મને ખૂબ આનંદ છે.



અમારા ગામમાં છઢી ઓક્ટોબર, ૨૦૦૪ના રોજ સરકાર તરફથી ગ્રામ સભા યોજાવાની હતી. મને તેની જાણ થઈ કે તરત જ મેં ગામના ભાઈ-બહેનોની મીટિંગ બોલાવી. તેમાં મેં ગ્રામ સભાનું મહત્વ સમજાવ્યું, સાથે સાથે સરપંચ અને પંચાયતના સત્તા અને ફરજો વિશે પણ લોકોને જાણકારી આપી. મીટિંગના અંતે અમે બધાએ સરકાર દ્વારા યોજવામાં આવેલી ગ્રામ સભાનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. અમે ગ્રામ સભા ભરીને જે દરાવ કરીએ છીએ તેનો ખરેખર કોઈ અમલ થતો નથી તે કારણે અમે ગ્રામ સભાનો વિરોધ જાહેર કરેલો. છઢી ઓક્ટોબરે તાલુકાના અધિકારીઓ ગામમાં આવ્યા અને મને કહેવા લાગ્યા કે, “બહેન, ૨૫ જેટલા માણસો તો ભેગા કરી આપો. અમારે ગ્રામ સભા ભરવાની છે.” ત્યારે મેં તેમને કહેલું કે, “સાહેબ, ગ્રામ સભા ગામ લોકોની છે અને તેને બોલાવવાનું કામ પંચાયતનું છે.

**તાલુકાના અધિકારીઓ ગામમાં આવ્યા અને મને કહેવા લાગ્યા કે, “બહેન, ૨૫ જેટલા માણસો તો ભેગા કરી આપો. અમારે ગ્રામ સભા ભરવાની છે.”**

પહેલાં અગાઉની ગ્રામ સભામાં થયેલા દરાવોનો અમલ કરો પછી જ બીજી ગ્રામ સભા યોજાશું.”

૧૧મી ઓક્ટોબરના રોજ તાલુકાએથી ફરી વાર ગ્રામ સભા જાહેર થઈ. ટીડીઓ સાહેબે મારી ઉપર ગ્રામ સભા ભરવાનું દબાસ કર્યું, પણ મેં મચક ન આપી. આખરે અમારા ગામની સંગઠન-શક્તિની જીત થઈ. ટીડીઓ સાહેબે અગાઉની ગ્રામ સભામાં થયેલા દરાવો મુજબ શાળાના બે ઓરડા, શાળાનાં કમ્પાઉન્ડની દિવાલ, આંગણવાડી રિપેન્ટિંગ અને છ કિલોમીટરનો પાકો રસ્તો કરી આપવાની બાંયધરી આપી. આંગણવાડી રિપેર કરવાનું કામ તો પૂરું પણ થઈ ગયું. હાલમાં શાળાના બે ઓરડા બાંધવાનું કામ ચાલુ છે. પહેલાં અમારા ગામમાં લોકો સંગઠિત નહોતા, ગ્રામ સભાનો વિરોધ કરવાના પ્રસંગે સૌ કોઈ એક થઈ ગયા એનો મને ખૂબ આનંદ છે.

આજે ગામમાં કોઈ પણ કામ કે યોજના આવે ત્યારે તેનો લાભ દરેક વ્યક્તિને સમાન રીતે મળે તેનું હું ધ્યાન રાખ્યું છું, મેં સાત હેઠળીં અને ફણિયામાં મેટલના રસ્તા બનાવી આચા છે. ગામનું યુવક મંડળ અને મહિલા મંડળ પણ સક્રિય બન્યું છે. ઉપસરપંચ શ્રી દશરથભાઈ ગામીત પણ મને સહયોગ આપે છે. ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને પણ હું સલાહ માર્ગદર્શન આપું છું.

(અનુસંધાન પાના નં.૪ ઉપર)

# કેરળમાં સ્થાનિક સ્વશાસનમાં ચૂંટાયેલી મહિલાઓના સંગઠનની મહેનતાણં વધારવાની માગણી ફળી

‘એસોસિએશન ઓફ વીમેન ઈલેક્ટેડ મેમ્બર્સ ઇન કેરળ’ એ કેરળ રાજ્યનું રજિસ્ટર્ડ સંગઠન છે. આ સંગઠનને નવી દિલ્હી સ્થિત સૈચિક સંસ્થા ‘પ્રિયા’ અને તેની સ્થાનિક ભાગીદાર સંસ્થા ‘સહાય’ કારા ટેકો પૂરો પાડવામાં આવે છે. આ સંગઠને કેરળના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીને પોતાનું માસિક મહેનતાણં વધારવા માટે માર્ય, ૨૦૦૪માં એક આવેદનપત્ર આપ્યું હતું. વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને વિકાસલક્ષી એજન્ડાનો અસરકારક અમલ કરવા માટે મહિલાઓએ ફાળવેલા સમય બદલ મહેનતાણં વધારવાની માગણી આ ચૂંટાયેલી મહિલાઓ કારા થઈ હતી. આ માગણી સ્વીકારવા માટે જુદાજુદા ચૂંટાયેલા સભ્યો કારા સરકાર ઉપર ખૂબ દબાણ કરવામાં આવ્યું, પરિણામે કેબિનેટ મીટિંગમાં ઓગસ્ટ-૨૦૦૪થી સ્થાનિક સ્વશાસનમાં ચૂંટાયેલા સભ્યોનું મહેનતાણં વધારવાનું નક્કી થયું. આ નિર્ણયથી કેરળ રાજ્યમાં નીચે પ્રમાણેનું મહેનતાણં અમલમાં આવ્યું છે:

## મહાનગરપાલિકા

પહેલાનું વધારો કર્યા		
મહેનતાણં પછીનું મહેનતાણં		
રૂપિયા રૂપિયા		
મેયર ૪૫૦૦/-	૫૪૦૦/-	
ડ. મેયર ૩૫૦૦/-	૪૨૦૦/-	
સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન ૨૦૦૦/-	૨૪૦૦/-	
ચૂંટાયેલા સભ્યો ૧૫૦૦/-	૧૮૦૦/-	

## નગરપાલિકા

પ્રમુખ ૪૦૦૦/-	૪૮૦૦/-	
ઉપપ્રમુખ ૩૦૦૦/-	૩૫૦૦/-	
સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન ૧૭૫૦/-	૨૧૦૦/-	
ચૂંટાયેલા સભ્યો ૧૨૫૦/-	૧૫૦૦/-	

## જિલ્લા પંચાયત

પ્રમુખ ૪૫૦૦/-	૫૪૦૦/-	
ઉપપ્રમુખ ૩૫૦૦/-	૪૨૦૦/-	
સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન ૨૦૦૦/-	૨૪૦૦/-	
ચૂંટાયેલા સભ્યો ૧૭૫૦/-	૨૧૦૦/-	

## તાલુકા પંચાયત

પ્રમુખ ૪૦૦૦/-	૪૮૦૦/-
ઉપપ્રમુખ ૩૦૦૦/-	૩૬૦૦/-
સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન ૧૭૫૦/-	૨૧૦૦/-
ચૂંટાયેલા સભ્યો ૧૨૫૦/-	૧૫૦૦/-

## ગ્રામ પંચાયત

પ્રમુખ ૩૫૦૦/-	૪૨૦૦/-
ઉપપ્રમુખ ૨૫૦૦/-	૩૦૦૦/-
સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન ૧૫૦૦/-	૧૮૦૦/-
ચૂંટાયેલા સભ્યો ૧૦૦૦/-	૧૨૦૦/-

ઉપરોક્ત સફળતા મેળવીને સંગઠનની મહિલાઓનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે.

(સ્લોટ : ‘સહાય’, કેરળ) ■

(અનુ. પાના નં. ૩ ઉપરથી)

અમારા તાલુકામાં ચાલતી ‘કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર’ અને અમારા ‘આદિવાસી સર્વાંગી વિકાસ સંધ’ની મદદથી જ હું આટલી સક્ષમ બની છું. ગ્રામ પંચાયત, ગ્રામ સભ્ય, પંચાયતના કાયદા-કાનૂન અને વહીવટ વિશે ‘કાનૂની કેન્દ્ર’ મારફતે જ મને જાણકારી મળી છે. હું હાલમાં વ્યારા કોર્ટમાં એક વકીલ તરીકે પ્રેક્ટિસ કરું છું.

હું દરેક સારા-નરસા પ્રસંગમાં ગામના લોકોની પડખે ઊભી રહું છું. ગામના ઝડપા ગામમાં જ પતે તે માટે હંમેશાં પ્રયત્ન કરું છું. મારા ઉમદા વાણી, વર્તન અને વ્યવહારના કારણે પણ લોકો મને આદર આપે છે એવું મને લાગે છે. મક્કમ બનોબણ અને કાયદાની જાણકારીથી મેં સફળતા મેળવી છે.

સરપંચ તરીકેનું મારું આ ચોથું વર્ષ ચાલે છે. ગામના લોકો મને ચૂંટીને તાલુકા સભ્ય બનાવવા માંગે છે. તેઓ કહે છે, ‘જેમ ગામમાં ચોખ્યો અને અસરકારક વહીવટ કર્યો એવો તાલુકામાં કરવાની જરૂર છે.’

(‘ચરખા’સાથેની વાતચીતના આધારે)

કિલુબહેન ગામીતનો ફોન નં. ૦૨૯૨૪-૨૪૧૨૦૨ (ઘર)

૨૨૧૮૭૪ (ઓફિસ) ■

## એક સરપંચના દટ સંકલ્પે ગુનેગારોના ગામની કાયાપલટ કરી

મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાનાં મજની ગામના લોકો એમની નજીક આવેલા જંગલ પર જ તેમની આજીવિકા માટે આધાર રાખતા હતા. જંગલનાં વૃક્ષો કાપીને કાયદાનો સરેઆમ

ભંગ કરીને તેઓ એમનો જીવનનિર્વાહ ચાલે એટલું રણી લેતા હતા. નવરાશનો સમય દારુ પીવામાં અને જુગાર રમવામાં જતો હતો. પોલીસ અને જંગલ ખાતાના અધિકારીઓ પણ આ ગામના રીઢા ગુનેગારોને નવ ગજના નમસ્કાર કરતા હતા.

જોકે, દસેક વર્ષ પહેલાં દબ્બલસિંઘ ગામના સરપંચ બન્યાને બધું બદલાઈ ગયું. શરૂશરુમાં તો એમણે બધું જેમ ચાલતું હતું. એમ જ ચાલવા દીધું, પણ ઉંડે ઉંડે એમને થતું હતું કે એમના ગામને બદનામીમાંથી મુક્ત કરવું જોઈએ. ગુનેગારોના ગામના સરપંચ હોવામાં બદનામી જ છે એમ એમને થતું. શાંતિ અને સુખથી જીવતાં બાજુનાં ગામોની મને ઈર્ષા થતી એમ દબ્બલસિંઘ કહે છે.

આજથી એકાદ વર્ષ પહેલાં દબ્બલસિંઘ ડિસ્ટ્રિક્ટ પોવર્ટી ઇનિશિએટિક પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર જી. એસ. તેકમને મળ્યા. તેકમે દબ્બલસિંઘને તમામ મદદની ખાતરી આપી પણ સાથે એક શરત પણ મૂકી કે ગ્રામવાસીઓએ દારુ - જુગારને ત્યજી દઈને ખેતી અપનાવવી પડશે. ગામના ગુનેગારોના ચહેરા યાદ આવતા દબ્બલસિંઘ થોડા ખચકાયા તો ખરા પણ પછી એમણે નિર્ધાર કરી લીધો કે ગામના ભલા માટે આ પરિવર્તન લાવ્યા વિના છુટકો નથી.

દબ્બલસિંઘ ગ્રામવાસીઓનો સંપર્ક કરવા માંડયો. એમને હકારાભક્ત પ્રતિસાદ પણ સાંપર્કવા માંડયો. પોવર્ટી ઇનિશિએટિક પ્રોજેક્ટ તરફથી મળતી આર્થિક સહાયને કારણે આખરે આખા ગામની સિકલ જ બદલાઈ ગઈ. જંગલોનાં વૃક્ષો કે લાકડાં કાપવા માટે થતી છૂપી ધૂસરાખોરી બંધ થઈ ગઈ. વર્ષો સુધી બંજર પડી રહેલી જમીનમાં પાક લહેરાવા લાગ્યા. મજનીની ધરતી હરિયાણી બની ગઈ. અગાઉ ભાગ્યે જ ૨૦ હુકટર જમીનમાં ખેતી થતી, તેને બદલે ૨૦૦ એકર જમીનમાં ખેતી થવા લાગી. મોટાભાગની જમીનને સિંચાઈ કારા પાણી મળવા

લાગ્યું. બે ટ્રેકટરો, એક ગ્રેસર અને એક સિંકલર સિસ્ટમ આવી ગયા. લોકોની સાચા માર્ગ વળવાની નિષ્ઠાનાં એ ફળ હતાં.

થોડા જ સમયમાં પાંચ હજાર લિટરની કેપેસીટીવાળી પાણીની ટાંકી પણ આવી જશે અને પાઈપ લાઈનો કારા લોકોને ચોખ્યું પાણી પહોંચાડાશે. છ બાયોગેસ એકમો પણ ઉભા કરાવાનાં છે. તેને કારણે રસોઈથી થતો ધૂમાડો નિવારી શકાશે. ગામના એક રહેવાસી પ્રમોદસિંઘ કહે છે કે આજુબાજુના કોઈ પણ ગ્રામવાસીને મજની ગામની આ કાયાપલટથી આશ્વર્ય થશે.

પરંતુ, આ કાયાપલટ કંઈ રાતોરાત થઈ નથી. ગામલોકોએ સ્વસહાય જુથો સ્થાપણ અને પોવર્ટી ઇનિશિએટિક પ્રોજેક્ટે આર્થિક સહાય કરી. જમીનને સમતળ કરાઈ, પાતાળકુવાઓ ખોદાયા, અને પંપો ચલાવવા માટે વીજળીની વ્યવસ્થા કરાઈ. જિલ્લા આયોજન સમિતિએ વીજળી માટે ૧ લાખ રૂપિયા ફણવ્યા તો ગામલોકોએ પોતે ૩૫ હજાર રૂપિયાનો ફણો એકઠો કર્યો.

થોડા સમયમાં તો ૩૦ જેટલાં સ્વસહાય જુથો પણ રચવામાં આવ્યાં. એ બધી મળીને ૨૦ લાખ રૂપિયાની આર્થિક સહાય મળી. રસ્તા, પાણી, વીજળી માટે પોણા છ લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ. દસેક જૂથે ૫૦થી ૭૦ કિવન્ટલ ઘઉં અને ચણા વાવ્યા. અડદની દાળનો પણ ખરીફ સીઝનમાં ઉતારો લેવાય. આ બધાના વેચાણમાંથી પૈસા તો મળ્યા જ, પણ લોકોને કંઈક સારું કામ કર્યાનો સંતોષ પણ પ્રાપ્ત થયો. લોકોમાં હવે તો એટલો ઉત્સાહનો સંચાર થયો છે કે તેઓ હવે નવા નવા પ્રયોગો પણ કરવા લાગ્યા છે. કોઈકે સૂરજમુખીની ખેતી શરૂ કરી છે, તો કોઈએ શાકભાજીની.

શાળાએ જવાની ઉમરનાં તમામ બાળકો હવે ભણવા જવા લાગ્યાં છે. ગામનો એક રહેવાસી કારક કહે છે કે અમારા માટે તો આ મોકથી જરાય કમ નથી, એનો રસ્તો અમને સરપંચ દબ્બલસિંઘ બતાવ્યો છે. ('જનસત્તા' દૈનિક)

## રાજ્યસ્થાનની પ્રેરણાદારી ગ્રામ પંચાયત : કુશલપુરા

ગયા વખતે જ્યારે પંચાયતી રાજમાં ચૂંટણી દરમ્યાન સરપંચની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે રાજ્યસ્થાનના લગભગ ૧૦,૦૦૦ પંચાયતના ઉમેદવાર અને તેના સમર્થકો જીતવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા. લાખો રૂપિયા પાણીની જેમ વાપરી નાખ્યા ! ગોળ, દાડુ, ચા-પાણી અને હંડા પીણા પીવડાવવા અને ખવડાવવા માટે હરિફાઈ ચાલતી હતી. નબળામાં નબળા ઉમેદવાર માટે પણ જીપ અને મોટરસાયકલ દોડી રહ્યા હતા. આવી દોડધામમાં રાજ્યસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ તાલુકાની કુશલપુરા પંચાયતમાં સરપંચપદના ઉમેદવાર નારાયણ સિંહને સાથે લઈને 'મજૂર કિસાન શક્તિ સંગઠન'ના પદયાત્રીઓની એક ટોળી ગામે ગામ ચાલીને જઈ રહી હતી. તેમની પાસે એક સાઇકલ હતી. તેમાં માઈક (લાઉડ સ્પીકર) અને બેટરી બાંધેલી હતી. ગામ આવતા જ સંગઠનના લોકો કઠપુતલીના ખેલ અથવા ગીત ગાઈને લોકોને એક જગ્યાએ ભેગા કરતા અને તેમનો ગામમાં આવવાનો હેતુ જણાવતા. તેમના દાવા અને આશ્વાસન બહુ જ અલગ હતા, તેઓ પોતાની સાથે એક પત્રિકા લાવેલા તેમાં કેટલીક શરતો લખી હતી. અત્યાર સુધી તો ચૂંટણીમાં લડતા ઉમેદવારની સામે ગ્રામવાસીઓ શરત રાખતા અને ઉમેદવારો મતની લાલચમાં તે શરત માની પણ લેતા, પરંતુ અહીં તો કાઈક અલગ જ વાત છે. ચૂંટણી લડતો ઉમેદવાર જ સામેથી શરતો રાખતો હતો. શરતો પણ કેવી વિચિત્ર પ્રકારની ! સરપંચ પદ માટેના ઉમેદવાર નારાયણસિંહની સાથે આવેલી ટીમનું કહેવું એવું હતું કે- 'અમે ન તો ચા-પાણી પીવડાવશું', 'ન તો ગોળ ખવરાવીશું', 'શરાબ તો ક્યારેય નહીં પીવડાવીએ', 'મતદાન કેન્દ્ર પર તમને લાવવા-મૂકવા ગાડીની સગવડ પણ નહીં આપીએ.' તમારે પોતે જ ચાલીને આવવું પડશે અને મત દેવો પડશે. અમે એટલું વચન તો જરૂર આપીએ છીએ કે ચૂંટણી જીત્યા બાદ જે કોઈ રકમ ગ્રામ પંચાયતના વિકાસ માટે આવશે, તેનો એક-એક પૈસો લોકોના હિતમાં અને લોકોની સલાહ પ્રમાણે ખર્ચાશે. એવું પણ વચન આપવામાં આવવું કે પંચાયતના દસ્તાવેજ ખુલ્લા રાખવામાં આવશે, કોઈ પણ વ્યક્તિ આવીને તેને જોઈ શકશે.

મતદાનાઓને 'મજૂર કિસાન શક્તિ સંગઠન'ની આ વાતો ગમી ગઈ અને નારાયણસિંહના મુકાબલામાં તેની સામે ઉભેલા ઉમેદવારે વધુ ખર્ચ કરવા છતાં પણ તે હારી ગયા અને નારાયણસિંહ સરપંચ બન્યા. તેમણે માત્ર ૩.૧૪૦૦/- નો ખર્ચ કર્યો હતો.

નારાયણસિંહ સરપંચ બન્યા. તેમણે માત્ર ૩.૧૪૦૦/- નો ખર્ચ કર્યો હતો. આમ તો સંગઠને ચૂંટણી ખર્ચની મર્યાદા ૩.૧,૦૦૦/- નિર્ધારિત કરી હતી, પરંતુ સરપંચના પદ પર જીત્યા પછી નારાયણસિંહના સાસરીયાવાળાએ મીઠાઈ વહેંચી જેનાથી તેનો ખર્ચ વધી ગયો. ૩.૪૦૦/- વધારે ખર્ચ થવાથી સંગઠનમાં ચર્ચા પણ કરવામાં આવી. આ રીતે પંચાયતી રાજીની ચૂંટણીમાં નવો ઈતિહાસ રચાયો ! કુશલપુરાની જેમ અજમેર જિલ્લાની જવાજ પંચાયત સમિતિની ટોડગઢ પંચાયતમાં પણ 'મજૂર કિસાન શક્તિ સંગઠન'ના તેજસ્સિંહ ચૂંટણી લડયા અને ૩.૧૦૦૦/- થી ઓછો ખર્ચ કરી જીત મેળવી. જ્યારે તેના વિરોધી ઉમેદવારે તો એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, તો પણ હાર્યા.

કુશલપુરાના સરપંચ બનેલા નારાયણસિંહ નક્કી કરેલું કે સંગઠનમાંથી તેઓ માત્ર ૩.૯૦ મજૂરી લેશે તથા પૂર્ણ સમયના સરપંચની જેમ કામ કરશે. પાછળાં સાડાચાર વર્ષમાં તેમણે આ વચન નિભાવ્યું છે.

ચૂંટણી જીત્યા બાદ જે કોઈ રકમ ગ્રામ પંચાયતના વિકાસ માટે આવશે, તેનો એક-એક પૈસો લોકોના હિતમાં અને લોકોની સલાહ પ્રમાણે ખર્ચાશે. એવું પણ વચન આપવામાં આવ્યું કે પંચાયતના દસ્તાવેજ ખુલ્લા રાખવામાં આવશે, કોઈ પણ વ્યક્તિ આવીને તેને જોઈ શકશે.

નારાયણ સિંહ જ્યારે ૧૯૮૭માં 'બરાર'ના રાજકીય વિદ્યાલયમાં ધોરણ-૮ના વિદ્યાર્થી હતા ત્યારે તેઓ સંગઠનના સ્થાપક 'અરુણા રોય,' 'શંકરસિંહ' અને 'નિખિલ ડે' ના સંપર્કમાં આવ્યા. તેમની ઇચ્છા તો સાર્વજનિક નિર્માણ વિભાગમાં ઠકેદાર થવાની હતી, પરંતુ ૧૯૮૦માં 'મજૂર કિસાન શક્તિ સંગઠન'ની સ્થાપના થતાં વિચારને બદલ્યો. ૧૯૮૧થી ૧૯૮૩ સુધી શ્રી નારાયણે 'સમાજ કાર્ય અને અનુસંધાન કેન્દ્ર' તિલોનિયાની સાથે મળી પીવાનાં પાણી માટે, બ્યાવર, જવાજ, ભીમ-દેવગઢ વિસ્તારમાં કામ કર્યું. ૧૯૮૩માં સંપૂર્ણ પણે સંગઠનને સમર્પિત થયા. ત્રણ વર્ષ સુધી સંગઠન કારા સંચાલિત રેશનની દુકાન ચલાવી અને માહિતીના અધિકારના સંદર્ભમાં ભાગ પણ લીધો.

મતદાનાઓને 'મજૂર કિસાન શક્તિ સંગઠન'ની આ વાતો ગમી ગઈ અને નારાયણસિંહના મુકાબલામાં તેની સામે ઉભેલા ઉમેદવારે વધુ ખર્ચ કરવા છતાં પણ તે હારી ગયા અને નારાયણસિંહ સરપંચ બન્યા. તેમણે માત્ર ૩.૧૪૦૦/- નો ખર્ચ કર્યો હતો.

નારાયણ સિંહ જણાવે છે કે તેનું મન ૧૯૮૫માં પણ ચૂંટણી લડવાનું હતું, પણ સંગઠનના સ્તર પર કોઈ નિર્ણય ન હોતો લેવાયો જેથી, તે ચૂંટણી લડી ન શક્યા. ૨૦૦૦માં થયેલી ચૂંટણીમાં સંગઠને તેઓને સરપંચ બનાવી દીધા. સંગઠન રાજકારણમાં શું કામ આવ્યું? આ સવાલનો જવાબ હતો કે ‘સંગઠન તો સદાય બીનસંગઠિત રાજનીતિમાં હતું, પરંતુ ચૂંટણીની રાજનીતિમાં આવવાનો નિર્ણય, લોકસુનાવણી દરમ્યાન લોકોના પડકારને લીધે લીધો’. લોકો સંગઠનને કહેતા કે, ‘ભષ્ટાચારને દૂર કરવાની વાત કરવી આસાન છે, પરંતુ એક ગ્રામ પંચાયત ચલાવવી બહુ જ મુશ્કેલ છે. કેટલીય ગોઠવણ કરવી પડે છે.’ સંગઠને આ પડકાર સ્વીકાર્યો અને ચાર જગ્યા પર સંરપચપદે ઉમેદવાર ઊભા રાખ્યા. પોતાના આદર્શ સાથે પ્રચાર-પ્રસાર કર્યો. બે ઉમેદવાર જીત્યા અને સંગઠને તેની કલ્યાન પ્રમાણે પંચાયતનું સંચાલન કર્યું. આજે પણ બંને ગ્રામ પંચાયતોના

કાગળો બધા માટે ખૂલ્લાં છે. કાર્યોમાં પારદર્શકતા રાખવામાં આવે છે અને પૂરી જવાબદારીથી કામ કરવામાં આવે છે. કુશલપુરામાં સરપંચ બન્યા પછી નારાયણ સિંહ પર્યાવરણ અને જળ સંરક્ષણના કામને અગ્રતા આપી. ૪૪ વર્ષ પછી તેમના કાર્યકાળ દરમ્યાન પહેલીવાર દુકાણ રાહત અંતર્ગત બંધપાળા, મગરીબંધ તથા કુશલપુરાથી ઓટોલિયાના રસ્તાનું બાંધકામ તથા બંધપાળા મરામતનું કામ થયું. પંચાયત વિસ્તારમાં ઝાડ અથવા રોપા કાપવા અથવા જાનવરોને ખવડાવવાનું બંધ કરવામાં આવ્યું. જે લોકોએ નિયમનું ઉલ્લંઘન કર્યું તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યાં. ઝાડ, રોપા બચાવવાનો એક ફાયદો તો એ થયો કે કુશલપુરાની સ્કૂલ પાસેનાં બાવળોની આવકમાંથી ૩૦ હજાર રૂપિયા બેગા થયા.

સરપંચ નારાયણે સંગઠનની સલાહ પ્રમાણે મધ્યાહન ભોજનમાં ધૂઘરીને બદલે દળિયા(થુલી) બનાવવાની શરૂઆત કરી. સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધારવા માટે શિક્ષકોની સાથે મળી ‘સ્કૂલ ચાલો’ અભિયાન કર્યું, સર્વે કરાવાયો તથા વૉર્ડ પંચ, સરપંચ તથા શિક્ષક, સ્કૂલે ન આવતા બધા વિદ્યાર્થીઓને મળ્યા. સરપંચે એમ પણ કહી દીધું કે જે મા-બાપ પોતાના છોકરા-છોકરીઓને સ્કૂલે નહીં મોકલે તેને પંચાયત તરફથી મળતી સુવિધારોથી વંચિત રાખવામાં આવશે. રેશનની દુકાનના ડીલરે સ્કૂલે ન જતાં બાળકોના વાલીઓને કેરોસીન દેવાની પણ ના પાડી દીધી. દુકાણ રાહત કાર્યોમાં જોડાવાની પણ તેમને ના પડવામાં આવી. આથી સો ટકા વિદ્યાર્થી શાળામાં દાખલ થયા. વિદ્યાલયોની ભૌતિક સુવિધાઓ પણ સુધારવામાં આવી.

**સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધારવા**  
**માટે શિક્ષકોની સાથે મળી ‘સ્કૂલ ચાલો’**  
**અભિયાન કર્યું, સર્વે કરાવાયો તથા વૉર્ડ પંચ,**  
**સરપંચ તથા શિક્ષક, સ્કૂલે ન આવતા બધા**  
**વિદ્યાર્થીઓને મળ્યા. સરપંચે એમ પણ કહી**  
**દીધું કે જે મા-બાપ પોતાના છોકરા-**  
**છોકરીઓને સ્કૂલે નહીં મોકલે તેને પંચાયત**  
**તરફથી મળતી સુવિધારોથી વંચિત**  
**રાખવામાં આવશે.**

મોરડીના દાંતા, ડાંગ અને સુનેતાનાં બાડિયામાં પાઠશાળા શરૂ કરવામાં આવી. ફેવડી, ગુંગારમાં શિક્ષકો માટે વિદ્યાલય બનાવ્યું. દેવકુંઝારી અને ધોરેલામાં પ્રાથમિક શાળા બની. કુશલપુરામાં માધ્યમિક શાળામાં ૪ ઓરડા બનાવ્યા. આર.સી. તીવોનીયાના સહયોગથી ત્રણ પાણીના ટાંકા પણ બનાવ્યા હતા. નિર્ધન વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે દાનવીરોનો સંપર્ક કરવામાં આવ્યો. બાવન લોકોએ આપેલા દાનમાંથી કપડાં, પેન, પેન્સિલ વગેરેનું વિતરણ કરાવ્યું. રમતગમત પણ યોજાતી. આંતરિક સ્કૂલ પ્રતિયોગિતા અને ભાઈચારા માટે કિકેટ મેચ પણ થઈ. સરપંચ નારાયણસિંહ ખૂબ ગર્વ સાથે કહે છે કે તેમની પંચાયતમાં તેમને પોતાને અછતના કામમાં વ્યક્તિગત મજૂરી ઓછામાં ઓછી મળી છે. આ ઐતિહાસિક ઉદાહરણ છે કે પંચાયતના સરપંચને ૩.૫૦ મળે છે અને તે જ પંચાયતના મજૂરને પણ ૩.૫૦ મળે છે.

નારાયણસિંહ જણાવે છે કે રાજસ્થાનની સૌથી પહેલી વૉર્ડ સભા

ઔપચારિક રીતે કુશલપુરા ગ્રામ પંચાયતના ધોરેલા ગામમાં થઈ હતી. આજે પણ દર મહિનાની ૫,૧૨, ૨૦ અને ૨૭ તારીખે સચિવાલયની બેઠક થાય છે. દરેક ગ્રામ સભા અને વૉર્ડ સભામાં નારાયણસિંહ પોતે હાજર રહે છે. વૉર્ડ, પંચોના સહયોગથી સભાઓની કોરમ પૂરી કરવાનો સફળ પ્રયત્ન કરાવ્યો છે. ગ્રામ સભાઓમાં ૨૦૦થી ૪૦૦ લોકો આવે છે.

બીજા ગામોમાં સરપંચ સામાન્ય વ્યક્તિ પાસેથી રૂપિયા ખાવા માંગે છે. વિકાસ કામોમાં કમિશન અને પ્રમાણપત્ર પર સહી કરવાને બદલે રસીદ ફાડવામાં આવે છે. કુશલપુરામાં આ પરંપરા પણ ખતમ થઈ ગઈ. સરપંચ બનવા તે સમયે જે વચન આપ્યા હતા તેનું પાલન થયું છે. ભષ્ટાચાર નહીં થાય, પૈસા સાચી જગ્યાએ વપરાશે, વૉર્ડ સભા/ગ્રામ સભાને મજૂબૂત કરાશે. ઓછામાં ઓછી મજૂરી પણ દેશે. આ બધા પર કામ થયું છે. દરેક ગામમાં મહાત્મા ગાંધી વાંચનાલય ખોલાવ્યાં છે. આંગણવાડીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ધાન બેંકની સ્થાપના કરવી એ એક મહત્વાકંસી પરિયોજના છે.

યુવાન સરપંચ નારાયણસિંહ અને ‘મજૂર કિસાન શક્તિ સંગઠન’નાં કામોને લીધે જ આ વિસ્તારમાં સાર્વજનિક બદલાવ પણ આવ્યો છે. છૂત-અધૂતના બેદભાવ મહદુંથે દૂર થયા છે. પર્યાવરણ પ્રત્યે ચેતના જાગૃત થઈ છે, મહિલાઓમાં આત્મનિર્ભરતા જોવા મળે છે. સાક્ષરતાની ટકાવારી વધી છે. પારદર્શિતા, જવાબદારી અને માહિતીના અધિકાર પર કામ થાય છે. આરોગ્ય સુવિધા વધી છે, પણ હજુ કામ કરવાની જરૂર છે તેથી પૂરા જોશથી નારાયણસિંહ કામે લાગેલા છે.

(સાલાર : સપ્તરંગ, જુલાઈ-ઓગસ્ટ ૨૦૦૪

# એક સંતાનનું ચીની મોડલ વસ્તી નિયંત્રણ માટે સ્પષ્ટ નીતિ અને કડક ઉપાય જરૂરી

મુલ્લા

રતમાં એક બાળકનો માપદંડ અપનાવવા સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને હજુ કોઈ નીતિ ધડી નથી. માત્ર એના પર ચર્ચા કરી છે. આઈએમએની કારોબારીની બેઠકમાં એક સભ્યે વ્યક્તિગત રીતે આ મુદ્દો ઉઠાવ્યો અને આઈએમએ દ્વારા તેના પર વિચાર-વિમર્શ થયો. તાજેતરમાં આઈએમએની એક ટુકડી ચીન ગઈ હતી અને ત્યાં જઈ તેમના અનુભવો જોઈને આવી છે. તેના આધારે અમારો અંદાજ છે કે જો વસ્તીને નિયંત્રણમાં રાખવી હોય તો કેટલાંક કડક પગલાં લેવા પડશે. ચીનમાં એવું છે કે પ્રથમ બાળકના ઉછેર અને શિક્ષણનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. બીજા બાળકને આ સુવિધા મળતી નથી અને જો કોઈને ત્રીજું બાળક થાય તો તેની ધરપકડ સુધ્યાં કરી લેવામાં આવે છે.

આપણે ત્યાં આવો કાયદો નથી. માત્ર નીતિઓના પ્રચાર-પ્રસાર દ્વારા વસ્તી નિયંત્રણના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એનું પરિણામ એ આવ્યું છે કે કોઈ પણ નીતિ સફળ થતી હોય એવું જોવા મળતું નથી. અલબત્ત, જો આપણે એક બાળકનું 'સ્ટાન્ડડ' ન અપનાવીએ તો પણ આપણે બાળકો માટેનો કાયદો તો બનાવવો જ જોઈએ અને તેનું કડકપણે અમલીકરણ થવું જોઈએ. જો આપણે અત્યારે એને અમલી બનાવવામાં સફળ થઈ શકીશું તો જ આપણે ચીનની જેમ એક બાળકના માપદંડને અપનાવવા લાયક બની શકીશું. એક બાળકનું 'સ્ટાન્ડડ' અપનાવવા કે



ડૉ. વિનય અગ્રવાલ

દેશમાં વસ્તી નિયંત્રણ કરવાની પહેલી શરત તરીકે આપણે બે બાળકોના માપદંડને અમલી બનાવવું જ રહ્યું. જૂની નીતિઓ ત્યારે જ સફળ થશે જ્યારે તેને કડકાઈપૂર્વક અમલી બનાવાશે. ભારત દુનિયાનો પહેલો દેશ છે, જેણે વસ્તીનીતિ તૈયાર કરી. દેશમાં લાંબા સમયથી વસ્તી વધારાને નિયંત્રિત કરવા

માટે અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ વસ્તીવિસ્ફોટનાં સૌથી માઠાં ફળો આપણે જ ભોગવી રહ્યા છીએ. નીતિઓની વિફળતા જ તેના માટે કારણભૂત છે.

કે ટલાંક ૨૧૪૦૦ એ  
વસ્તીવધારાને રોકવા  
માટે અમુક કડક પગલાં  
ભર્યા છે. તેનાથી સ્થિતિ  
કાબૂમાં આવી શકે છે.

આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સરકાર એક કે બે બાળકો માટે પ્રોત્સાહન આપવાનો કેટલાક ઉપાય કરે છે. બે બાળકોવાળાં દંપતીને સુવિધાઓ અપાય છે અને આર્થિક મદદ પણ અપાય છે. આમ, જેમ વસ્તી નિયંત્રણ માટે પ્રોત્સાહનના પ્રયાસો કરવામાં આવી શકે તેમ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં પણ લઈ શકાય. સરકારની કોઈ પણ નીતિ ત્યારે જ સફળ થશે જ્યારે તેને અમલી કરવાની નીતિ સ્પષ્ટ હશે અને ઉલ્લંઘન કરનાર માટે દંડની જોગવાઈ હશે.

(લેખક ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મહામંત્રી છે.)



આમને

# ભારત માટે કેટલું યોગ્ય ?

## આવી નીતિ માનવ અધિકારો

### અને મહિલાઓની વિસ્તૃત હશે

આ

ત્યારે તો અમે બે બાળકોના માપદંડને અપનાવવાનો વિરોધ કરી રહ્યા છીએ. એવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને એક બાળકના માપદંડ પર ચર્ચા શરૂ કરી દીધી છે. આ તદ્દન અયોગ્ય વાત છે. આ માનવ અધિકારોનું

ઉલ્લંઘન અને સ્ત્રી વિરોધી વલણ છે. સરકાર એક બાળકનું 'સ્ટાન્ડર્ડ' અપનાવે અને તેને અમલી બનાવે એ તો આ દેશ માટે એક આફિસ રૂપ સાબિત થશે. તેનું નુકશાન ફરી ભરપાઈ નહીં કરી શકાય. અત્યારે જે દાસ્તાવીની નીતિઓ અપનાવવામાં આવી છે તેનું પરિણામ એ આવ્યું છે કે તેની સ્ત્રી-પુરુષ પ્રમાણ પર ખૂબ નકારાત્મક અસર પડી છે. કેટલાંક રાજ્યોમાં એક હજાર પુરુષો સામે મહિલાઓની સંખ્યા આઠસો કે તેથી પણ ઘટી ગઈ છે. તમામ પ્રયાસો છતાં લિંગ પરીક્ષણ અને ભૂણ હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. જો એક બાળકનું 'સ્ટાન્ડર્ડ' અપનાવી લેવાય તો તો પછી બાળકીઓની સંખ્યામાં વધુ ઘટાડો થશે. દરેક વ્યક્તિ છોકરો ઈચ્છશે અને તેના લીધે ભૂણ હત્યામાં વધારો થશે. અત્યારે જ કેટલાંક રાજ્યોમાં એવી સ્થિતિ નિર્માણ પામી છે કે લોકો લગ્ન માટે બહારથી છોકરીઓ ખરીદી



શ્રી ઉષા રાથ

લાવે છે. આ સ્થિતિ વધારે પણ બગડી શકે છે. એટલે એક બાળકના માપદંડ પર તો વિચારાનું જ ન જોઈએ, બલકે બે બાળકોવાળા માપદંડને પણ પડતો મૂકવો યોગ્ય છે.

ભારતમાં લોકો ચીનનું ઉદાહરણ લઈને ફરતા રહે છે કે ત્યાં એક બાળકનો કાયદો અપનાવી લેવાયો છે અને તેને કારણે ત્યાં બધું બરાબર થઈ ગયું છે. વાસ્તવમાં ત્યાં જરાય બરાબર નથી. ચીન લાંબા સમયથી પોતાના એક બાળકના માપદંડ પર પસ્તાવો કરી રહ્યું છે, ત્યાં પણ જે વ્યવસ્થા નિષ્કળ ગઈ છે એ નકામી વ્યવસ્થાને આપણે અપનાવવા માટે મથી રહ્યા છીએ. આ ભારત માટે બહુ ધ્યાતક પુરવાર થઈ શકે છે.

આજે એવી સ્થિતિ છે કે લોકો પોતે જ વધારે બાળકો ઈચ્છાતાં નથી, કયાં તો એક બાળક ઈચ્છે છે અથવા એક પણ ઈચ્છાતા નથી. એટલે લોકોની ઈચ્છાનો ઝ્યાલ રાખવો જોઈએ અને તેમના પર જબરદસ્તીથી કોઈ નિયમ થોપવો જોઈએ નહીં. બેથી વધારે બાળકોવાળાને ચૂંટણી ન લડવા દેવી એવા કાયદા-નિયમો કરવા જોઈએ નહીં. સરકાર પહેલાં શિક્ષણનો પ્રસાર કરે, સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે અને ગર્ભ નિરોધક સાધનોનો વ્યાપક પ્રચાર કરે, એવું થવું જોઈએ. આવા ઉપાયો કારા જ ભારતમાં અસરકારક રીતે વસતી નિયંત્રણ બાબતે વિચારી શકાશે.

(લેખિકા વર્ણિક વિકાસલક્ષી પત્રકાર છે.)

(સાભાર : 'દિવ્યભાસકર' ફૈનિક)

# પોતાના ગર્ભ પર મહિલાઓનું પોતાનું જ નિયંત્રણ હોવું જોઈએ, સરકાર કે કુટુંબનું નહીં

-મણિમાલા

મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે જે ખેડૂતને બે કરતાં વધારે બાળકો હશે તેમને પાણી નહીં અપાય. રેશનકાર્ડ પણ નહીં આપવાનો કાયદો છે અને આ પહેલાં કેટલીય જગ્યાએ કાયદો છે કે આવા લોકો પંચાયત ચુંટણી લડી શકશે નહીં. એક બીજો પ્રસ્તાવ પણ છે કે બેથી વધારે બાળકોવાળાં માતા-પિતા પાસેથી મતદાનનો અધિકાર પણ ઝૂટવી લેવામાં આવે. જો સંસદ અને વિધાનસભાઓમાં આવું શક્ય ન હોય તો કમ સે કમ પંચાયતોમાં તો કરી જ શકાય છે. એક એવી સલાહ પણ અપાઈ રહી છે કે બેથી વધારે બાળકોવાળા પરિવારોને ગરીબો માટે બનેલી કોઈ પણ યોજના અંતર્ગત કોઈ મદદ નહીં આપવામાં આવે. એ સ્પષ્ટ છે કે બે બાળકો સુધી પરિવારોને સીમિત રાખવાનાં નામે દરેક પ્રકારના પ્રહાર ગરીબો પર જ થવાના છે.

રોજગારમાં એ જ રોજગાર આવશે જે ગરીબો માટે છે. અમલદારશાહીની પરીક્ષામાં બેસનાર લોકો તો ભાગ્યે જ લગ્નગ્રંથિથી જોડાયેલા હોય છે. બાળકો હોય એવા તો લગભગ હોતા જ નથી. એ ઉમરે તો એકથી વધારે બાળકો હોય એવું બની જ ન શકે. હવે ચુંટણીમાં ભાગીદારીની વાત કરીએ તો તેને પણ પંચાયત ચુંટણી સુધી જ મર્યાદિત રાખવામાં આવી રહી છે. પૈસાદાર અને શક્તિશાળી લોકો પોતાનું ભાગ્ય સંસદ અને વિધાનસભાઓમાં અજમાવે છે. શું આપણે ત્યાં પંચાયતો એટલી અસરકારક બની ગઈ છે ખરી કે હવે તેમાં પણ ભાગીદારી અટકાવીને રાજકારણ ખેલવાની વાત વિચારાઈ રહી છે. અત્યાર સુધી તો ગ્રામ સભાઓ અને પંચાયતોએ અનેક મૂળભૂત સંદેશાઓ પણ પૂરા પ્રસાર્યા નથી. અલબત્ત ભાગીદારી કરવાની ઈચ્છા જરૂર પેદા થવા લાગી છે.

કુટુંબ નાનું રાખવાની વાત એની જગ્યાએ જરૂર યોગ્ય જ છે, પરંતુ કોઈનો જીવનાનો અધિકાર જ

છીનવાઈ જાય એ રીતે તો કુટુંબ નાનું ન રાખી શકાય ને. આ કાયદાઓ અને પ્રસ્તાવો પરથી તો એવું લાગે છે કે વસતી વધારવામાં માત્ર ગરીબો જ જવાબદાર છે. એટલે રેશનકાર્ડ જપ્ત કરવાની અને ગરીબો માટે ચલાવવામાં આવતા રોજગાર કાર્યક્રમો અંતર્ગત આપવામાં આવતી મદદને રોકવાની વાત પણ સાથોસાથ કહેવામાં આવી રહી છે. જાહેર છે કે રેશનકાર્ડ પર સસ્તું મળતું કરોસીન, અનાજ, તેલ કે અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ લેવા માટે ગરીબો જ જાય છે. ડમણાં જ અખબારમાં એક નાનકડા સમાચાર છપાયા હતા જેમાં જણાવાયું હતું કે ગાંઝિયાબાદમાં લોખંડ પીગળાવવાના એક કારખાનામાં માલિકે એક નવયુવાનને સળગાવીને મારી નાખ્યો. તે વ્યક્તિ પર લોખંડ

ચોરવાનો આરોપ હતો. તેની માતા પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ ત્યારે તેને એલફેલ બોલીને ભગાડી દેવામાં આવી. તે પોતાની માનું એકમાત્ર સંતાન હતો. તેની માતાને જીવન ચલાવવા માટે શું હવે રોજગાર મળશે? શું બેકે બેથી ઓછાં બાળકો પેદા કરનારાઓ માટે રોજગારીની કોઈ ગેરન્ટી છે? એવા રોજગારની, જેમાં આ રીતે કોઈને પોતાની જિંદગી ન ગુમાવવી પડે? હવે કોઈ મારો દીકરો પાછો લાવી આપશે? કોણ બનશે મારો સહારો? અમીર લોકો તો પૈસાની મદદથી એકલા પણ જીવન જીવી શકે છે, પરંતુ અમારા જેવા ગરીબોનો સહારો તો માત્ર અમારાં બાળકો જ હોય છે. પ્રશ્નો ભલે કોઈ સામાન્ય મહિલાએ જ ઉઠાવ્યા હોય, પરંતુ છે બધું મહત્વના! પ્રશ્ન વસતી પર નિયંત્રણથી વધારે તો તેના નિયોજનનો છે. યોગ્ય નિયોજન થકી જ નિયંત્રણ કરી શકાશે. એ વાત પણ જરૂરી છે કે પોતાના ગર્ભ પર મહિલાઓનું પોતાનું જ નિયંત્રણ હોવું જોઈએ. ન સરકારનું, ન સમાજનું કે ન કુટુંબનું. (સુશ્રી મણિમાલા દિલ્હી સ્થિત જાણીતા કર્મશીલ છે.)

# વેળાવદરનો વટ : અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ગૌચર ઉપરનું દબાણ હટાવ્યું

- ભરત ગોહિલ

તખાજાથી ભાવનગર રોડ તરફ જતાં ૧૦ કિ.મી. દૂર કાંઠાનું ગામ વેળાવદર છે. ગામમાં પંચોલી, આહિર, રજપૂત, બ્રાહ્મણની વસ્તી ઉપરાંત દરબાર જ્ઞાતિનાં ઘર છે. લોક વ્યવસ્થાપિત ઘોધા પ્રાદેશિક પાણી પુરવઠા અને સ્વચ્છતા યોજના (નેધરલેન્ડ સરકાર સહાયિત) અંતર્ગત પીવાનાં પાણીની સુવિધા અને પાણીસંગ્રહનાં કામોની જવાબદારી ગામની પાણી સમિતિ નિભાવી રહી છે. ગામમાં ‘પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર’ કારા અવાર નવાર પાણી, આરોગ્ય અને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ થાય છે. ગામમાં યુવાન સરપંચ અને યુવાન પાણી સમિતિ ઉત્સાહી છે. ગામમાં જાગૃતિ કાર્યક્રમ હોય, શાળાકીય કાર્યક્રમ હોય કે સ્વચ્છતા વિષયક શોષખાડાનો કાર્યક્રમ હોય દરેકમાં આ ગામે પહેલ કરી છે.

‘વાસ્મો’ સંસ્થાનો નવો કાર્યક્રમ ગૌચર જ મીન સુધારણા આવ્યો. આ કાર્યક્રમમાં ભાગીદાર થવા ગ્રામપંચાયત/પાણી સમિતિએ પોતાની ગૌચર જ મીન આ કાર્યક્રમ માટે ફાળવવાની રહે છે. આ ફાળવેલી જ મીનમાં સફાઈ કરી, ખેડ કરી, ધામણ, રાણીયાર, રલજ્યોત જેવાં ધાસચારાનું વાવેતર કરવામાં આવે છે. ગૌચરના શેઢે રલજ્યોતનું વાવેતર તથા વનતલાવડી, ટ્રેન્ચ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરીની જવાબદારી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવેલી છે. ગૌચર જ મીનનો વિકાસ કર્યા બાદ તે ગામ પંચાયતને પરત સોંપવામાં આવે છે. ત્યારબાદ ગ્રામપંચાયત-પાણી સમિતિ આ વિકાસ પામેલા પ્લોટની જાળવણી તથા નિભાવણી કરશે. ગામની આવકનું નવું સાધન ઉભું થશે.

ઉપરોક્ત કાર્યક્રમ માટે ગ્રામપંચાયત / પાણી સમિતિની સંયુક્ત બેઠક મળી. તેમાં સર્વાનુમતે ગામના બે ખરાબાની સર્વ નં. ૨૮/૧ પીઆઈ ૨૩ હે/ ૪૮ એ/ ૨૦ ગુંડા જ મીન આ કાર્યક્રમ માટે ફાળવવી અને યોજનાનો સંપૂર્ણ લાભ

અંતે તેમણે વર્ષોથી સરકારની બિન કાયદેસર વાવેતર કરતા હતા તે જ મીન ખુલ્લી કરી આપી. આ પ્રક્રિયા સતત ત્રણ દિવસ ચાલતી રહી. ઘણાં બધાં દબાણ આવ્યાં, ઘાક ઘમકી મળી, બદનામી થઈ. અંતે પાણી સમિતિનો વિજય થયો, લોક ભાગીદારીનો વિજય થયો. અંતે પાણી સમિતિના નિર્ણય મુજબ જ મીન માપણી માટે ફી ભરી સર્વેયરને બોલાવ્યા.

લેવો એવું દરાવવામાં આવ્યું. દરાવ થયા પછી કામગીરી ફોરેસ્ટ વિભાગ કારા શરૂ કરવામાં આવી. પંચાયત, સરપંચ અને મંત્રીશ્રી કારા જ મીન સ્થળનું નિર્દર્શન કરવામાં આવ્યું. ફોરેસ્ટ વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર જોખી સાહેબના માર્ગદર્શન તળે કામ શરૂ થયું. ગૌચર જ મીન પ્લોટમાં ૧૨ હેક્ટર કામ થયું. બાકી કામમાં ખેડૂતોએ વિરોધ કર્યો. તેમણે ગૌચરની જ મીન ઉપર પોતાની માલિકીનો દાવો કર્યો અને કામ બંધ થયું. પાણી સમિતિને આ કામગીરી બંધ થતા અસંતોષ થયો. અંતે પાણી સમિતિની મીટિંગ મળી અને ગામનું ખરેખર ગૌચર ખુલ્લું કરાવીને આ કામમાં ઉપયોગ લેવા માટે નિર્ણય થયો. જરૂર પડ્યે લેન્ડ રેકર્ડ વિભાગમાં પંચાયત કારા ફી ભરી ખરેખર ગૌચર તથા જ મીન માલિકીની હંડ નક્કી કરવી એવું નક્કી થયું. સાર પંચાશ્કી દિનોશાભાઈ જી જાબા, મેંદજી ભાઈ, પોપટભાઈ તથા અન્ય સભ્યો સંમત થયા. તલાટી-મંત્રીએ પાણી સમિતિના નિર્ણય મુજબ જ મીન માપણી માટે ફી ભરી સર્વેયરને બોલાવ્યા.

પાણી સમિતિ અધ્યક્ષશ્રી, સભ્યોશ્રીની હંડ પહેલા માપી દબાણ ખુલ્લું કરવા હંડ નક્કી કરી. પાણી સમિતિના સભ્યો સહમત થયા, કામ આગળ ચાલ્યું. એક પછી એક ખેતરની માપણી થઈ. અંતે ૧૧ હેક્ટર ગૌચરની જ મીન ખેડૂતોએ દબાણ કરેલી તે ખુલ્લી કરી, ફરતી બાઉન્ડ્રી કરી. ખેડૂતોએ વિરોધ કર્યો, પરંતુ સમસ્ત ગામના નિર્ણય સામે તેઓ ઢુંકા પડ્યા. અંતે તેમણે વર્ષોથી સરકારની બિન કાયદેસર વાવેતર કરતા હતા તે જ મીન ખુલ્લી કરી આપી. આ પ્રક્રિયા સતત ત્રણ દિવસ ચાલતી રહી. ઘણાં બધાં દબાણ આવ્યાં, ઘાક ઘમકી મળી, બદનામી થઈ. અંતે પાણી સમિતિનો વિજય થયો, લોક ભાગીદારીનો વિજય થયો. એક નવા ગૌચર વિકાસ કાર્યક્રમનો અને લોક ભાગીદારીની નવી પહેલ બાબતે

વેણવદરનો વટ પડી ગયો. આ સમગ્ર કામગીરીમાં ‘પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર’ જંગલ ખાતુ તथા તલાટી-કમાં મંત્રીનો પૂરતો સહયોગ અને માર્ગદર્શન મળ્યા. ગૌચર જમીન સુધારણા માટે જે.સી.બી.થી કામ થતું અટક્યું. રાતે સરપંચશ્રી અને પાણી સમિતિના સભ્યો ગયા, સાથે ગામ આગેવાનોને રાખ્યા. સરપંચશ્રીએ પોતાનું દબાણ સ્વેચ્છાએ ખુલ્લું કર્યું જેસીબીથી ટ્રેન્ચ ખોડી આગણ વધ્યા. બીજા ત્રણ-ચાર ખેડૂતો પોતાની જમીનમાં ઉભા રહ્યા અને ગૌચરની સરહદ નક્કી થઈ ગઈ. આ રીતે દર રોજ પાણી સમિતિ, માઝ સરપંચ તથા ગામના આગેવાનોએ જઈ ગૌચર ખુલ્લુ કરાયું. એક-બે ખેડૂતોએ પાણી સમિતિના આ ઉત્સાહ સામે પોલીસ કેસ કર્યો, મારવાની ઘમકી આપી, પરંતુ પોપટભાઈ સરપંચ તથા ઉપસરપંચ ભરતભાઈ બારૈયા હિંમત હાર્યા નહીં. તેમણે નક્કી કર્યું હતું કે, ગૌચર ખુલ્લું કરાવીને જ રહેવું છે. અંતે ગૌચર ખુલ્લું થયું.

આ ગૌચર સુધારણા કાર્યક્રમમાં ગાંડાભાવણા થડીયા કાપી ખ્લોટ સાફ કરવાની જવાબદારી પાણી સમિતિએ ઉપાડી. અંતે પાણી સમિતિને ખર્ચ બાદ કરતાં ગાંડા ભાવણા લાકડાની ૬૫,૦૦૦ રૂપિયાની આવક થઈ. પાણી સમિતિએ સંપૂર્ણ હિસાબ કરી ગૌચર જમીન કાર્યક્રમનો ચોખ્ખો નફો પાણી સમિતિના બેંક ખાતામાં જમા કરાવ્યો. વધ્યા તે ૨૦,૦૦૦ રૂપિયા જળ વ્યવસ્થાપનના કાર્યક્રમના લોકફાળમાં જમા કરાવ્યા. ત્યાર પછી તળાવ ઊંડું કરવાનું નવું કામ મળ્યું. લોકફાળો ભરપાઈ થતાં કામ શરૂ કર્યું.

આ ગૌચર સુધારણા કાર્યક્રમમાં  
ગાંડાભાવણા થડીયા કાપી ખ્લોટ સાફ  
કરવાની જવાબદારી પાણી સમિતિએ ઉપાડી.  
અંતે પાણી સમિતિને ખર્ચ બાદ કરતાં ગાંડા  
ભાવણા લાકડાની ૬૫,૦૦૦ રૂપિયાની આવક  
થઈ. પાણી સમિતિએ સંપૂર્ણ હિસાબ કરી ગૌચર  
જમીન કાર્યક્રમનો ચોખ્ખો નફો પાણી સમિતિના  
બેંક ખાતામાં જમા કરાવ્યો. વધ્યા તે  
૨૦,૦૦૦ રૂપિયા જળ વ્યવસ્થાપનના  
કાર્યક્રમના લોકફાળમાં  
જમા કરાવ્યા.

લાકડાની ૬૫,૦૦૦ રૂપિયાની આવક થઈ. પાણી સમિતિએ સંપૂર્ણ હિસાબ કરી ગૌચર જમીન કાર્યક્રમનો ચોખ્ખો નફો પાણી સમિતિના બેંક ખાતામાં જમા કરાવ્યો. વધ્યા તે ૨૦,૦૦૦ રૂપિયા જળ વ્યવસ્થાપનના કાર્યક્રમના લોકફાળમાં જમા કરાવ્યા. ત્યાર પછી તળાવ ઊંડું કરવાનું નવું કામ મળ્યું. લોકફાળો ભરપાઈ થતાં કામ શરૂ કર્યું.

૧૫-૨૦ દિવસમાં તળાવ પૂર્ણ થયું.

વિરોધ કરનાર ગ્રામજનો

આ સમગ્ર કામગીરી જોઈ ચૂપ થયા. વિકાસના કામ માટેની આ લોકભાગીદારીની પ્રક્રિયાની અસાર આજુબાજુનાં ગામોમાં પહોંચી, પછી તો વેણવદર, અલંગા, ભાંખલ, મથાવડા, ભારાપરા વગેરે ગામોમાં પણ ચોપડા ગામના માર્ગ ચાલીને સૌએ લોકફાળો જમા

કરાવ્યો. આ ગામોએ હિન્દી કહેવત-“આમ કે આમ ગુટલીઓ કે દામ” સાચી પાડી. ગૌચર ખુલ્લું થયું. નમૂનારૂપ કામ થયું અને લોકફાળો ભરપાઈ થયો. ગ્રામજનોનો આ સામૂહિક પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. ■

## તમારું પંચાયત જ્ઞાન ચકાસો

**દ્વારા આ અંકનો પ્રશ્ન :** ગ્રામ પંચાયતની બેઠકનો ઠરાવ ગ્રામ સભાના સભ્યોને મળી શકે કે કેમ ? કેવી રીતે ?

**૧૫ દિવસમાં આપના જવાબો લખી મોકલો અને એક બેટ મેળવો.**

ગયા અંકનો જવાબ : હા, સરપંચ અને ઉપસરપંચ બન્ને વિલદ્ધ એક સાથે જુદીજુદી અરજ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરી શકાય.

### અભિનંદન

ગયા અંકની કસોટીના સાચા જવાબો આપનારા વાચકોનાં નામ નીચે મુજબ છે:

ક્રમ	નામ	ગામ	તાલુકો	જિલ્લા
૧.	મધુબહેન જી. ખાંડવી	કૌકા	ધોળકા	અમદાવાદ
૨.	રમેશભાઈ નાનુભાઈ ચૌહાણ	મોકળ	કાલોલ	પંચમહાલ



# પુસ્તક જગત

જ્ઞાન એ વિકાસના દરેક તબક્કમાં પાયાની જરૂરિયાત હોય છે. વિવિધ તક અને પડકારો અંગેની જાણકારી, ચોક્કસ આયોજન, યોગ્ય વિકલ્પોની પસંદગી અને અમલીકરણ માટે જાગૃતિ ફેલાવવાની જરૂર છે.

આજે ગ્રામીણ વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ અમલમાં છે, પરંતુ લોકો સુધી તે અંગેની જાણકારીના અભાવે તે માટે ફળવાયેલાં નાણાં વણવપરાયેલાં પડી રહેતાં હોય છે. તેથી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે.


આ માર્ગદર્શિકામાં સમાજના તમામ વર્ગોને આવરી લઈને તેમના વિકાસની દિશામાં માર્ગ ચીંધતી યોજનાઓનું સંકલન કરવામાં આવ્યું છે. આ યોજનાઓ ભારત સરકારનાં વિવિધ મંત્રાલયો દ્વારા પ્રાયોજિત કરવામાં આવી છે. ગ્રામ વિકાસની યોજનાઓથી ગ્રામીણ લોકો અજાણ ન રહી જાય તે માટે આ માર્ગદર્શિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સામાન્ય જન પણ મંત્રાલયનો સીધો સંપર્ક સાધી શકે તે માટે સરનામાં, ફોન નંબર સહિત વેબસાઈટની નોંધ પણ માર્ગદર્શિકામાં આપવામાં આવી છે. આ માર્ગદર્શિકા વધુ લોકોપથોગી બને તે માટે સરળ ભાષા, યોજનાનું ચિત્ર સ્પષ્ટ કરતાં રેખાચિત્રો, ઉપરાંત માર્ગદર્શિકામાં ઉપયોગમાં લેવાયેલા ટૂંકાખરોની સૂચિ પણ મૂકવામાં આવી છે.

આ માહિતી જનસમૃદ્ધાય, પંચાયતી રાજની સંસ્થાઓ, સરકારી તથા બિનસરકારી સંસ્થાઓને ઉપયોગી નીવડશે એવી છે.

ગુજરાત-ગ્રામ વિકાસ યોજનાઓની માર્ગદર્શિકામાં સૈચિંદ્ર સંસ્થાઓ, સમૃદ્ધાય આધારિત સંસ્થાઓ અને પંચાયતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સામાજિક ન્યાય અને સશક્તિકરણ, ફણી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ, હસ્તકલા, શિક્ષણ, સ્વરોજગાર, મકાન અને માળખું, વન અને સ્વરચ્છતા, આદિવાસી, મહિલા અને બાળ, મરુભૂમિ વિકાસ, સંસ્કૃતિ, ઉર્જા, યુવા, હાથસાણ વગેરેને લગતી યોજનાઓ આવરી લેવામાં આવી છે.

‘પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદ (સીઈઈ)’ કારા પ્રસિદ્ધ આ માર્ગદર્શિકાના કાર્યક્રમ સંયોજક- માધવી જોષી છે. સંશોધન અને સંકલન પ્રમોદકુમાર શર્મા, પ્રાર્ચી પટવારી, નિર્માણ- ડી.એમ. થુંબર, સંપાદન- તેજલ વાકપૈજન, અનુવાદ - જિતેન્દ્ર બાંધણિયા, સપના

બારૈયા, સહયોગ-સમૃદ્ધા પરમાર, રેખાંકન: ઇલેસ્ટ્રેશન બેન્ક સી.ઇ.ઇ., રૂપાંકન-જાગૃતિ-ધિરેન પંચાલ દ્વારા થયું છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના અન્ય સાથીદારો પણ નિર્માણ પ્રક્રિયામાં સહયોગી નીવડયા છે. આ પુસ્તક નીચેના સ્થળે ઉપલબ્ધ થઈ શકશે. ■



પ્રાન્તિકસ્થાન : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ-૩૮૦ ૦૫૪. ફોન : ૨૬૮૫૮૦૦૨, ૨૬૮૫૮૦૦૬

કિંમત : દર્શાવી નથી.



# સમાચાર જ્યોતિ

## બાવળા તાલુકાના ભાયલા ગ્રામ સભા માટે આવેલા અધિકારીઓને ગામના ગ્રામજનોએ ભગાડચા

અમદાવાદના બાવળા તાલુકાના ભાયલા ગામે સોમવારે સાંજે ગ્રામ સભા યોજવાનો અભરણો સરકારી તંત્રને ભારે પડી ગયો હતો. ગામના આગેવાનોએ હુર્રિયો બોલાવી ગ્રામ સભાનો બહિકાર કરી સરકારી અધિકારીઓને રીતસર પાછા કાઢ્યા હતા.

ભાયલા ગામના ઐદૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે સરકારી અધિકારીઓએ તા.૪ને સોમવારે સાંજે ૬ વાગ્યાના અરસામાં ગામને ચોરે આવી ગામના આગેવાનોને બોલાવી ગ્રામ સભા યોજવાનો પ્રયાસ કરતાં મામલો બિચકચો હતો. ગામના આગેવાનોએ તીવ્ર આકોશ સાથે સરકારી અધિકારીઓને સંભળાવ્યું હતું કે ગયા વર્ષ ત્રૈ ગ્રામ સભા યોજી ત્યારે ગામમાં કોંમ્યુનિટી હોલ બનાવી આપવાની, ફિલેવાડી કેનાલમાં સાફસુરી કરવાની સહિત સંખ્યાબંધ માગણી ઉકેલવાની સરકાર તરફથી તમે ખાતરી આપી હતી. આજે એ વાતને વર્ષ પૂરું થયું છે છતાં સમ ખાવા પૂરતું એકેય કામ થયું નથી. માત્ર નાટક કરવા ખાતર ગ્રામ સભા યોજવાની હોય અને એકેય માગણી સંતોષવાની ન હોય તો એમને એવી ગ્રામ સભામાં કોઈ રસ નથી. ગામના ૩૦-૪૦ જેટલા આગેવાનોની આ આકમકતા જોઈ સરકારી અધિકારીઓ તો હરી જ ગયા હતા. મામલો વધારે તંગ બનતાં કેટલાક ઠરેલ આગેવાનોએ અધિકારીઓને તાત્કાલિક ગમ છોડી જવા જણાવ્યું હતું જેને પગલે અધિકારીઓએ ઘટનાસ્થળ છોડી દીધું હતું.

બાદમાં અધિકારીઓએ જિલ્લા કલેક્ટરને બનાવની જાણ કરતાં આ સમાચાર વાયુવેગે ગાંધીનગર સુધી પહોંચ્યા હતા.

(ગુજરાત સમાચાર દૈનિક, તા.૫-૪-૦૫)

## ભીમપુરાના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં ડે. ડીડીઓની ભૂમિકાથી વિવાદ

આઠ નીલગીરીના સુકાયેલા લાકડા વાડામાં રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવેલા ભીમપુરા ગામના મહિલા સરપંચ કેલાસબહેન વસાવાના કિસ્સામાં વડોદરા જિલ્લા પંચાયતના

ડેયુટી ડી.ડી.ઓ વસાવાની ભૂમિકા અંગે એક નવું રહસ્યોદઘાટન થયું છે તથા વિવાદ સર્જાયો છે.

કેલાસબહેન વિરુદ્ધ તૈયાર કરવામાં આવેલા કેસમાં એક તર્ક એ રજૂ કરાયો હતો કે તેમણે નીલગીરીના સુકાયેલા આઠ લાકડાની હરાજુમાં વિલંબ કર્યો હતો....! ભીમપુરા(કુ)ના મહિલા સરપંચને આ હરાજુ તથા તે માટેની તારીખ નક્કી કરવાની સત્તા આપતો હરાવ ભીમપુરા ગ્રામ પંચાયતે તા.૧૮મી નવેમ્બરના રોજ કરી દીધો હતો જેથી તેમની સામે ઉભો કરવામાં આવેલો કેસ બિલકુલ નભણો પડી જતો હતો. તા. ૧૮મી નવેમ્બરના આ હરાવની બાતમી વડોદરા જિલ્લા પંચાયતની પંચાયત શાખાના સંબંધિત અધિકારીને મળી ગઈ હતી અને તેમને કેસ નભણો પડતો જણાતાં તેમણે પોતાનો અભિપ્રાય રજૂ કરી કેલાસબહેનને સસ્પેન્ડ કરવા ડી.ડી.ઓ. થેનારસની સહી કરાવી હતી. આ પ્રક્રિયા મોડી સાંજે કરાવાઈ હતી. ભીમપુરા ગ્રામ પંચાયતમાં ૧૮મીએ થયેલા હરાવની બાતમી પંચાયત શાખાના અધિકારીને કોણે આપી અને કેમ આપી તે સ્વયંસ્પષ્ટ છે.

કેલાસબહેન વસાવાને જો સસ્પેન્ડ જ કરવાના હતા તો તે અગાઉ પણ કરી શકાય હોત, પરંતુ કઈ માગણી પૂર્ણ થવાની રાહ જોવાતી હતી તે સમજાતું નથી. કેલાસબહેનને સસ્પેન્ડ કરવા માટે પૂરતાં કારણો હતાં જ નહીં, તેમણે કોઈ ચોરી કરાવી નહોતી કે બદદીરાદાથી રીતે નીલગીરી વાડામાં મુકાવી નહોતી.

કેલાસબહેન સામે વૃક્ષછેદન ધારા હેઠળ પણ કોઈ પગલાં લેવાયાં નહોતાં તથા ડભોઈના મામલતદારે ૨૫ ફેલ્બુઆરીની પત્રમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે નીલગીરીનો નિયત કરેલાં વૃક્ષોમાં સમાવેશ જ થતો નથી અને આ ઝાડ ઐતીની વ્યાખ્યામાં આવે છે. વધુમાં કેલાસબહેન સામે કોઈ ચોરીની પોલીસ ફરજિયાદ પણ થઈ નહોતી. આઠ લાકડા તેમના વાડામાં મુકવા પંચાયતના સભ્યોએ જ અનુમતિ આપી હતી અને મજૂરોનો ખર્ચ પણ પંચાયતમાં પાડવામાં આવ્યો હતો. આટલી સ્પષ્ટતાઓ સાબિત કરતી હતી કે કેલાસબહેન સામે કોઈ પગલું લેવું વાજબી નહોતું.

પંચાયત શાખાના ડી.ડી.ઓ પોતે પણ નક્કી કરી શકે તેમ હતા કે કેસમાં દમ નથી અને તેને દફતરે કરવા ડી.ડી.ઓને અભિપ્રાય આપી શકાય હોત....!

રાજ્યના વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતનો હુકમ કાયદેસરનો નથી તેમ જણાવી તેમને ફરીથી બહાલ કરી દેવા

માટે રેણુ ડિસેમ્બરના રોજ હુકમ કરી દીધો હતો, પરંતુ કૈલાસબહેનને ફરીથી બહાલ કરાવવાનો આદેશ વડોદરા જિલ્લા પંચાયતમાંથી ૨૨ દિવસ પછી ડભોઈ તાલુકા પંચાયતમાં મોકલવામાં આવ્યો હતો. આટલો બધો વિલંબ કેમ કરાયો તે પણ વિવાદાસ્પદ છે.

( સંદેશ, વડોદરા તા.૨૫-૧-૦૫)

## રાજ્યનાં ૧૯૦ ગામો તીર્થગ્રામ જાહેર થયાં

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગ્રામ વિસ્તારમાં રહેલા લોકો વચ્ચે પરસ્પર સંદ્રભાવ વધે, કોમી એખલાસની ભાવના પ્રબળ બને, એકત્ર જગત્વાય તેમ જ ભાઈચારાની ભાવના વધે તેને ધ્યાનમાં રાખીને સમગ્રતઃગ્રામકષાએ સમરસ થયેલું ગામ તેમ જ છેલ્લાં એક વર્ષમાં ગામમાં એક પણ ગુનો નોંધાયેલો ન હોય તેવી ગ્રામ પંચાયતો માટે તીર્થગ્રામ યોજના જાહેર કરી છે. જે હેઠળ ૨૦૦૪ સુધીમાં રાજ્યનાં ૧૯૦ ગામડાઓને તીર્થગ્રામ જાહેર કરાયાં છે. તીર્થગ્રામ તરીકે જાહેર થયેલ ગામડાઓના સર્વીંગી વિકાસ માટે રૂપિયા ૧ લાખ સુધીનું ઇનામ અપાશે. વર્ષ ૨૦૦૫-૨૦૦૬ માટે કુલ ૧૦ કરોડ પૈકી આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ રૂપિયા ૧ કરોડ ૮૦ લાખ તથા ખાસ અંગભૂત યોજના હેઠળ રૂપિયા ૬૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

(ગુજરાત સમાચાર, તા.૩-૪-૦૫)

## બે હજાર ગામોમાં અલગ

### શૌચાલયો નથી

ધારાસભ્ય બણવંતસિંહ રાજપૂતના એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં શિક્ષણમંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જુલાઈ-૨૦૦૪ની સ્થિતિએ રાજ્યના ૨૫ જિલ્લાઓનાં ૨૧૬૯ ગામોને કન્યાઓ માટે અલગ શૌચાલયની સુવિધા પૂરી પાડી શકાઈ નથી.

શિક્ષણમંત્રીના જણાવ્યા મુજબ છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ જિલ્લાનાં ૨૫૧ ગામો, આણંદનાં ૧૦૨ ગામો, બનાસકંઠાનાં ૨૦, ભડુંનાં ૨૩૩, ભાવનગરનાં ૨૦, દાહોદનાં ૧૮૭, જામનગર જિલ્લાનાં ૧૦૦, જૂનાગઢ જિલ્લાનાં ૮૮, કચ્છ જિલ્લાનાં ૮૮ અને નર્મદા જિલ્લાનાં ૨૧૨ ગામો એમ કુલ દસ જિલ્લાઓમાં કન્યાઓ માટે અલગ શૌચાલયોની સુવિધા ઉભી કરવા પાછળ રૂપિયા ૪૦ લાખ ૨૮ હજાર જેટલો ખર્ચ સરકાર તરફથી કરવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રીના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૫-૦૬ના શૈક્ષણિક

વર્ષ દરમ્યાન સરકાર તરફથી ૧૫૭૮ નવા સંકુલો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે જિલ્લાઓમાં કન્યાઓ માટે અલાયદા શૌચાલયો નથી તેની વિગતોમાં અમદાવાદ જિલ્લાનાં ૧૦૬૮ ગામોનો સમાવેશ થાય છે.

ઉપરાંત, અમરેલી જિલ્લાનાં ૫૪૩ ગામો, આણંદ જિલ્લાનાં ૬૬૭, બનાસકંઠ જિલ્લાનાં ૧૮૨૮, ભડું જિલ્લાનાં ૮૩૫, ભાવનગર જિલ્લાનાં ૫૮૨, દાહોદ જિલ્લાનાં ૧૨૭૫, દાંગ જિલ્લાનાં ૭૫, ગાંધીનગર જિલ્લાનાં ૪૬૮, જામનગર જિલ્લાનાં ૧૦૨૮, જૂનાગઢ ૧૦૦૪, ખેડાનાં ૧૧૦૩, કચ્છનાં ૬૭૫, મહેસૂણાનાં ૩૭૭, નર્મદાનાં ૫૫૧, નવસારીનાં ૩૩૦, પંચમહાલયાનાં ૧૪૩૮, પાટણનાં ૩૫૧, પોરંદરનાં ૨૧૪, રાજકોટનાં ૩૩૦, સાબરકંઠાનાં ૨૦૦૩, સુરતનાં ૬૭૭, વડોદરાનાં ૧૨૯૪ અને વલસાડનાં ૩૦૮ ગામોનો સમાવેશ થાય છે.

(ગ્રામ ગર્જના, તા.૧-૪-૦૫)

## રાજ્યની ૫૮૦૦ ગ્રામ પંચાયતો ઈ-ગ્રામ યોજના હેઠળ કોમ્પ્યુટરાઈઝ કરાશે

રાજ્ય સરકારે ઈ-ગ્રામ વિશ્વગ્રામનો આદર્શ પૂર્ણ કરવાની દિશામાં મહત્વના નિર્ણયો કર્યા છે. તદ્દનુસાર, ડિસેમ્બર-૨૦૦૪ સુધીમાં કુલ ૫૬૭ ગ્રામ પંચાયતોને કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે. આના ભાગરૂપે લોકફણા દ્વારા ૧૮૦૦ ગ્રામ પંચાયતો તથા રાજ્ય સરકારની સીધી સહાયથી ૪૦૦૦ મળી કુલ ૫૮૦૦ ગ્રામ પંચાયતોને કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવશે.

આ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને પણ કોમ્પ્યુટરાઈઝેશન કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે.

## રાજ્યની ગૌચર જમીનો અન્ય હેતુ માટે ફાળવવામાં આવશે નહીં

રાજ્યમાં આવેલી ગૌચરની જમીનો અન્ય હેતુઓ માટે ફાળવવામાં આવતી હતી. પશુધનની સંખ્યાને નજરમાં રાખી અન્ય હેતુ માટે ફાળવવાનું બંધ કરવા મહેસૂલ વિભાગે નિર્ણય કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક તરફ રાજ્યમાં પશુધન વધી રહ્યું છે અને લોકો પશુધનને બચાવવા જાગૃત બન્યા છે ત્યારે ગૌચરની જમીનનો પ્રશ્ન ઉભો થવા પામે છે. રાજ્યમાં અત્યારે કચ્છ, પાલનપુર જેવા વિસ્તારોમાં અર્ધઅછત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ વિસ્તારના પશુધનને ઘાસ મળી રહે તેવા સ્થળોએ માલધારીઓ લઈ જશે જેથી પશુધન માટેની ગૌચરની જમીનનો પ્રશ્ન વધુ વિકટ બનશે.

(રખેવાણ, તા.૨૪-૩-૦૫ )

# જમીન દફતરની કોમ્પ્યુટરાઈડ નકલ તાલુકા મથકે લેવા જવું પડે : હસ્તલિખિત નકલ ગામમાંથી મળી રહેશે

રાજ્યના તમામ તાલુકામથકો પર જે-તે તાલુકાના તમામ ગામનું જમીન દફતરનું કોમ્પ્યુટીકરણ થઈ ગયેલ હોઈને જમીન દફતરની કોમ્પ્યુટરાઈડ નકલ જે-તે તાલુકામથકથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તાલુકામથકથી નકલ મેળવવી ન હોય તેમને ગામના તલાટી-કમ-મંત્રી પાસેથી હસ્તલિખિત નકલ મળી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, ગામમાંથી તાલુકામથકોને કોમ્પ્યુટીકરણ કરવા માટે લઈ જવાયેલ જમીન રેકર્ડ ઘણાં ગામોમાં પરત મોકલવામાં આવ્યું નહિ હોઈને ગામ લોકોને ગામમાંથી જમીન દફતરને લગતી નકલ મેળવવામાં તકલીફ પડી રહી હોવાનું બહાર આવ્યું છે.

રાજ્યના તમામ ૨૨૫ તાલુકામથકો પર જે-તે તાલુકાનાં ગામનું જમીન દફતર લઈ જઈને કોમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. કોમ્પ્યુટીકરણ કરેલ નકલ તાલુકામથક પર પ્રથમ વખત વિના મૂલ્યે અને એ પછી ફી લઈને આપવામાં આવે છે. ગામના ખેડૂતે આ માટે તાલુકા મથક સુધી નકલ લેવા ન જવું હોય તો ગામમાં જ તલાટી-કમ-મંત્રી પાસેથી હાથે લખેલ નકલ મળે એવું આયોજન કરવામાં આવેલ છે.

કોમ્પ્યુટીકરણ કરવામાં આવેલ વિગતમાં ૭/૧ રના નમુનામાં જમીન ધારણકર્તાનું નામ, ખેડૂત તરીકે નામ, ક્ષેત્રફળમાં ફેરફર બિનખેડૂત-ખેડૂત-ગણોતીયા વગેરે પ્રકારની વિગતો દર્શાવવામાં આવે છે.

જમીનના દફતરનું કોમ્પ્યુટીકરણ કરવામાં કેટલીક મુશ્કેલીઓ રહેલી છે જે નિવારવાના પ્રયાસો હાથ ધરાયા છે. કોમ્પ્યુટર જમીનનું ક્ષેત્રફળ એકર-ગુંડામાં સ્વીકારતું નથી. હુકટરમાં સ્વીકારે છે એટલે એ મુજબ ઉલ્લેખ કરવો પડે તેમ છે. જમીન દફતરનું કોમ્પ્યુટીકરણ થઈ રહેલ હોઈને જમીનને

લગતા દસ્તાવેજો કરનારાઓએ કાળજી રાખવી પડશે. દસ્તાવેજ કરતાં પહેલાં જે જમીનનો દસ્તાવેજ કરવાનો હોય તેનાં અધ્યતન કોમ્પ્યુટર ૭/૧૨ અને ૮-અ ની અધિકૃત નકલ ખાતેદાર પાસેથી મેળવીને બરાબર ચકાસણી કરવી અને તેમાં નીચેના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા:

(૧) રેકર્ડમાં ખાતેદારનું જે નામ સામેલ હોય તે જ નામ રાખવું. જો ઉંફ કે બીજું નામ હોય તો કોમ્પ્યુટર તે સ્વીકારશે નહીં.

(૨) ખરીદનાર જે ગામે ખાતેદાર હોય અને તેનું ખાતું હોય તે જ ખાતામાં ખરીદેલ જમીન જમા થવાની હોઈ ખરીદનાર કયા નામનું ખાતું ધરાવે છે તેની વિગત ખરીદનારનો રેકર્ડ તપાસીને ખાતરી કરવી, જેથી નવી ખરીદેલ જમીન કોમ્પ્યુટર તેના ખાતામાં જમા કરે. અન્યથા એક જ વ્યક્તિના જુદી રીતનાં જુદાં નામના બે ખાતાં ઊભાં થશે જે ખોટું ગણાશે. ખરીદનાર અન્ય ગામોએ ખાતું ધરાવતો હોય ત્યારે બંને ખાતામાં સામાન્ય રીતે એક જ પ્રકારનાં નામ ન હોવાં જોઈએ. તેથી ખરીદનારે તેના આવાં ખાતાં નામની વિગતની રેકર્ડ તપાસીને ખાતરી કરવી.

કોમ્પ્યુટરાઈડ નકલમાં જૂનો સર્વે નંબર અને નવો સર્વે નંબર બંને ઉલ્લેખ કરવામાં આવતો હોઈને કાનૂની કાર્યવાહીમાં સરળતા રહે છે. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ એસ.એન.દવેના જણાવ્યા મુજબ કોમ્પ્યુટરની નકલ મળતાં બેંકની લોન, ખેતી વિષયક સબસિડી, વીમા કલેઇમ વગેરે બાબતોમાં સરળતા રહેશે.

(સંદેશ, તા. ૧૩-૪-૨૦૦૫)



તંત્રી :	બિનોય આચાર્ય, ડાયરેક્ટર, ઉન્નતિ
સંપાદક :	સંજય દવે - ચરખા
રૂપાંકન :	પ્રકાશ ઓર્જા - ઉન્નતિ

નાગરિક નેતૃત્વ અને અભિશાસન એકમ

ઉન્નતિ-વિકાસ શિક્ષણ સંગાઠન

૭૦૨, સાકાર-૪, અમ. જે. લાઈબ્રેરી સામે, આશ્રમ રોડ,  
અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોન: (૦૭૯) ૨૬૫૮૩૩૦૫, ૨૬૫૮૮૮૫૮

બૂક પોસ્ટ

પ્રિન્ટેડ મેટર

પ્રતિ શ્રી, \_\_\_\_\_

\_\_\_\_\_  
\_\_\_\_\_